

GIL/SEC/OCT/022/2024-25

25th October, 2024

To, BSE LTD. 25th FLOOR, P. J. TOWER DALAL STREET, MUMBAI-400 001.

SUB.: PUBLICATION OF FINANCIAL RESULTS IN NEWSPAPER

Dear Sir/Madam,

With reference to above subject, we enclosed herewith copy of Newspaper Cutting of Financial Results published in the following Newspapers.

- (1) The Economic Times: English language (Ahmadabad Edition) Dated October, 25 2024, Friday.
- (2) Nav Gujarat Samay: Gujarati language (Ahmadabad Edition) Dated October 25, 2024, Friday.

Kindly take the same in your record.

Thank you

Yours sincerely, For Gujarat Intrux Limited

Rajyaguru Sagar Rameshbhai 12:12:17 +05'30'

Digitally signed by Rajyaguru Sagar Rameshbhai Date: 2024.10.25

SAGAR RAJYAGURU

Company Secretary & Compliance Officer Encl.: As above

CIN No. L27100GJ1992PLC016917 REGD. OFFICE & WORKS : Survey No. 84/P. 17 Km. Rajkot-Gondal Road, Village Shapar. Pin-360 024. RAJKOT (INDIA)

Phone : +91 - 2827 - 252851 e-mail : info@intricastindia.com, info@gujaratintrux.com Website : www.intricastindia.com www.gujaratintrux.com



Markets: Beating Volatility

Softer Yields, Cash Pile Help RBI Mop up Bonds in Oct Buyback

GOLD RATE

OPEN

US (\$/0z)

2742.50





MARGIN SQUEEZE Raw material inflation led by leaf tobacco and paper a key factor

Costs a Drag on ITC's Q2, D-St Show may Stay Muted


Kiran Somvanshi

ET Intelligence Group: ITC's September quarter performance was characterised by a strong uptick in revenue growth but a sharp slip in profitability. While the top line rose 16% to cross the ₹20,000 crore mark driven by the agriculture and hotel business segments, the operating profit margin dropped 330 bps to 31.1%.

Raw material cost inflation was the single biggest factor that hurt margins. The raw material cost surged 29% year-on-year led by the rise in prices of leaf tobacco and wood. The raw material cost as a proportion of sales rose from 40.2% in the same quarter last year to 44.6% this year.

The cigarette business revenues rose 7% with differentiated and premium brands doing well. However, the segment's margins dropped 100 bps due to severe cost escalation of leaf tobacco prices despite measures such as cost rationalisation and price increases.

In fact, except for the hotel business, all other segments suffered a decline in their profitability. The hotel business revenues grew 12% on a high base quarter with over 130 bps improvement in margins. Food & beverages, retail and wedding businesses drove the growth in the segment.



Parameters	₹ crore	YoY % Chg	Parameters	₹ crore	YoY % Chg
Gross Sales	20,360	16	EBITDA	7,214	4
Cigarette	8,177	7	Cigarette	5,023	5
FMCG	5,578	5	FMCG	442	1
Hotels	728	12	Hotels	151	20
Paper & Packaging	2,114	2	Paper & Packaging	242	-23
Agri Business	5,780	47	Agri Business	455	27
	-		Op Profit Margin*	31.1	-330 bps
	F	E F	Net Profit	5,079	3
			*(% of net sales)		

The agribusiness revenues surged 47% p. on the back of leaf tobacco and value-added agri products like coffee, fruits, vegetables and spices. The FMCG business revenues grew at a modest 5% with the notebookssegment impacted by high base effect and opportunistic play by local brands in the wake of a sharp drop in paper prices. As a result, the segment margin dropped 37 bps to 7.9%. The paper & packaging business was the worst-performing segment with 2% growth in revenues and a23% drop in profit. Unseasonal rains adversely im-

pacted wood availability, quality and procurement price. The segment witnessed subdued realisation amidst a surge in domestic wood prices and ocean freights. This led to the margin declining by 290 bps

the margin declining by 380 bps. With modest gains of nearly 9%, the ITC stock has underperformed the benchmark index over the past one year. The stock closed nearly 2% lower on Thursday in anticipation of a subdued quarterly show. The actual performance may further worsen the negative market sentiment.



India (₹/10Gm)

75520.00

Scaling back microloan book hits NIMs, NPAs rise; lender confident of uptick ahead

OIL (\$/BRL)

DUBAI CRUDE

75.77


Our Bureau

Mumbai: Private sector lender IndusInd Bank posted a 39% fall in its September quarter net profit to ₹1,325 crore on the back of higher provisions. Analysts tracked by Bloomberg had estimated the net profit to be ₹2,214 crore. The bank had reported a net profit of ₹2,181 crore in the same quarter a year ago.

"If you look at our profitability, our profit could have been ₹1,733 crore, but we took a provision of ₹525 crore just to make sure that we are well fortified to take care of any eventuality on the balance sheet," said Sumant Kathpalia, managing director of IndusInd Bank.

The lender posted a 5% growth in its net interest income to ₹5,347 crore. Meanwhile, the net interest margin for the quarter under review stood at 4.08%, down by 21 bps from 4.29% reported in the quarter last year. The scaling back of growth in the mi-

The scaling back of growth in the mi-



crofinance book led to a contraction in the net interest margin (NIM).

"In the next few quarters, if the microfinance book comes back, we should see NIMs back at original levels of 4.2-4.3%," Kathpalia said.

In terms of asset quality, the gross nonperforming asset (NPA) ratio increased by 9 basis points year-on-year to 2.11%, while the net NPA ratio expanded by 7 basis points to 0.64%.

Kathpalia said the lender held contingent provisions of ₹1,525 crore outside its provision coverage ratio due to the challenging business environment.

The bank's total loan book grew 13% year-on-year to ₹3.57 lakh crore. The bank slowed down unsecured loans as it saw higher delinquencies. Outstanding slippages on the microfinance book stood at ₹2,259 crore, higher than ₹1,988 crore in the June quarter. Delinquencies in the microfinance book are prominently from Bihar, Jharkhand and Maharastra. Kathpalia added that the microfinance and vehicle finance portfolios should grow in the second half of the fiscal year 'We have to watch RoAs (return on assets) a lot, which come from these two businesses - microfinance as well as vehicle finance," he said. "The vehicle finance volumes are picking up, so we should see the business coming back to where it is. In the microfinance business, we have to be a little watchful."

OPEN

84.07

LAST

84.04

The banks grew deposits by 15% on-year to ₹4.12 lakh crore.

"Almost all consumer segments — vehicle, cards, microfinance — saw a sequential deterioration in the asset quality, with slippages for consumer segment rising 13% sequentially," said Pranav Gundlapalle, analyst with Bernstein. "With loan growth for thefirst half at13%, meeting the full year growth guidance of 18-23% and credit quality guidance becomes increasingly challenging."

NIFTY FMCG INDEX PLUNGES 2.8%, BIGGEST SINGLE-DAY DROP IN 28 MONTHS HUL Sneezes, FMCG Catches a Cold

Ruchita Sonawane

Mumbai: Stocks of fast-moving consumer goods (FMCG) tumbled on Thursday, driven by concerns over sector leader Hindustan Unilever's (HUL) declining revenue.

The Nifty FMCG Index plunged nearly 3%, its steepest single-day drop in 28 months after HUL's second-quarter results missed expectations, disappointing investors. Analysts anticipate continued margin pressure for consumer companies in the near term due to rising raw material costs and weak urhan demand.

The Nifty FMCG shed 2.8%, while the urban demand.

benchmark Nifty dipped 0.15%. The sectoral index declined nearly 12% lastmonth compared to the 6% fall in the Nifty 50.

"HUL's commentary highlighted the slowdown in the urban segment, mirroring what we saw with Nestle and Tata Consumer Products," said Preeyam Tolia, senior research analyst at Axis Securities. "While rural demand remains stable, margin pressure is likely to persist due to volatility in palm oil and crude oil prices."

Tolia also noted that ITC's diversified business might shield it from the full impact on margins, but investors will watch closely for further guidance on urban demand.

HUL stock fell 5.8%, while Colgate Palmolive and Marico dropped 3.4% and 3.2%, respectively, Godrej Consumer Products declined 3%, and Britannia Industries, Dabur, and Nestle were down by about 2%. Tata Consumer Products declined by 1.67% and ITC by 2%. Earlier this week, Nestle India chairman Suresh Narayanan warned that the FMCG sector is grappling with sluggish demand, driven by a combination of factors, including rising food inflation.

Many analysts highlighted the challenges posed by inflationary pressures, which are affecting consumer spending and dampening growth in the sector:





A TRULY INDIAN FOUNDRY WITH A GLOBAL PRESENCE!

Registered Office: G 1-2, New Market, Khasa Kothi, Jaipur, Rajasthan - 302001 E-mail: info@skfin.in || Phone : 0141-4161300 CIN: U65923RJ1994PLC009051

SK FINANCE LIMITED





GUJARAT INTRUX LIMITED CIN : L27100GJ1992PLC016917

Regd. Office : Survey No. 84/P,17 K.M. Rajkot-Gondal Road, Village : Shapar, Dist. Rajkot-360 024. India

Particulars	Quarter ended 30.09.2024 (Un-Audited)	Year to date figures 30.09.2024 (Un-Audited)	Corresponding 3 Months ended in the previous year 30.09.2023 (Un-Audited)	Year to date previous year ended 31.03.2024 (Audited)
Total Income from operations (net)	1640.16	3199.19	1535.32	5720.18
Net Profit/ (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	352.59	701.07	326.23	1015.69
Net Profit/ (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	352.59	701.07	326.23	1015.69
Net Profit/ (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	270.47	530.78	234.59	741.48
Total Comprehensive Income for the period [(Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	270.47	530.78	234.59	735.82
Equity Share Capital	343.53	343.53	343.53	343.53
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of Previous year)	5802.61	5802.61	5508.70	5855.84
Earning Per Share (before extraordinary items) (of Rs.10/- each) (not annualised except last column) Basic : Diluted :	7.87 7.87	15.45 15.45	6.83 6.83	21.42 21.42
Earning Per Share (after extraordinary items) (of Rs.10/- each) (not annualised except last column) Basic : Diluted :	7.87 7.87	15.45 15.45	6.83 6.83	21.42 21.42

Notes :

[1] The above is an extract of the detailed format of Financial Results for the quarter and half year ended on 30.09.2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and amendments thereof. The full format of the financial results are available on the website of BSE at www.bseindia.com and on Company's website at www.gujaratintrux.com.

[2] This statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind-AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognized accounting practices and policies to the extent applicable.

FOR AND ON BEHALF OF THE BOARD OF GUJARAT INTRUX LIMITED

PLACE : SHAPAR (Dist. RAJKOT) DATE : 24-10-2024

DHIRAJ D. PAMBHAR MANAGING DIRECTOR DIN :- 00187371



STEEL AND ALLOY STEEL SAND CASTING

Survey No. 84/P., 17 K.M. Rajkot-Gondal Road, Village: Shapar, Dist.: Rajkot-360 024. India Phone : 02827-252851 www.gujaratintrux.com Extract of unaudited financial results for the quarter ended September 30, 2024 [Regulation 52 (8), read with Regulation 52 (4) of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("LODR Regulations")]

(₹ in lakhs except otherwise stated)

~		Quarte	Year ended	
S. No.	Particulars	September 30, 2024 (Unaudited)		March 31, 2024 (Audited)
1	Total Income from Operations	58,855.36	45,477.62	1,79,119.46
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/ or Extraordinary items)	9,974.02	9,541.19	39,932.13
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/ or Extraordinary items)	9,974.02	9,541.19	39,932.13
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/ or Extraordinary items)	8,077.63	7,268.57	31,192.33
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	7,972.25	7,126.36	31,090.04
6	Paid up Equity Share Capital	1,338.53	644.35	1,337.44
7	Reserves (Excluding Revaluation Reserve)	3,25,103.07	2,64,480.56	3,09,520.66
8	Securities Premium Account	2,09,999.86	1,82,387.08	2,09,539.12
9	Net Worth	3,25,497.30	2,64,625.14	3,10,053.95
10	Paid up Debt Capital / Outstanding Debt	9,92,638.19	7,57,716.17	8,93,487.97
11	Outstanding Redeemable Preference Shares	Not Applicable	Not Applicable	Not Applicable
12	Debt Equity Ratio	3.05	2.86	2.88
	Earnings Per Share (of Rs. 1 each) (for continuing and discontinued operations)#			
13	Basic	6.04	6.06	25.00
	Diluted	5.99	5.98	24.70
14	Capital Redemption Reserve	Not Applicable	Not Applicable	Not Applicable
15	Debenture Redemption Reserve	Not Applicable	Not Applicable	Not Applicable
16	Debt Service Coverage Ratio	Not Applicable	Not Applicable	Not Applicable
17	Interest Service Coverage Ratio	Not Applicable	Not Applicable	Not Applicable

Earning per share for the interim periods is not annualized.

Notes:

- (a) The above is an extract of the detailed unaudited quarterly financial results filed with Stock Exchange under Regulation 52 of the LODR Regulations. The full format of the unaudited quarterly financial results is available on the websites of the BSE Ltd. (www.bseindia.com) and the website of the Company (www.skfin.in).
- (b) For the other line items referred in regulation 52(4) of the LODR Regulations, the pertinent disclosures have been made to the BSE Ltd. and can be accessed on www.bseindia.com.
- (c) There is no impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies for the quarter ended September 30, 2024.
- (d) The previous period's / year's figures have been regrouped / reclassified, wherever necessary, to correspond with the current period's / year's classification / disclosure.
- (e) The basic/ diluted earning per share for the prior periods have been restated considering the face value of Rs. 1/- each in accordance with the Ind AS 33- 'Earnings per share'.

For and on behalf of the Board of Directors

Place : Jaipur Date : October 24, 2024 Sd/-Rajendra Kumar Setia Managing Director & CEO DIN- 00957374

& **© 1800 1039 039** | www.skfin.in

ગેઢડાવ

સોમનાથનું ગૌરવ ઉજાગર કરતો થ્રીડી લાઈટ- સાઉ<u>ન્ડ શો આજથી શરૂ</u> થશે

સિંહની વસતી વધી છે અને આ શિકારી પ્રાણી હવે શિકારની શોધમાં છેક માનવ વસ્તીમાં જઈ ચઢે છે. ખાંભાના રાયડી ગામમાં ગત રાતે એક ડાલામથ્થો સિંહ શિકારની શોધમાં ગામની શેરીઓમાં આવી ચઢતા

રાયડી ગામમાં આંટા મારતો સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. ગામમાં ગત રાત્રીના એક સિંહ શિકારની શોધમાં આવી ચડ્યો હતો. શેરીઓમાં રખડતા પશુઓ આરામ કરમાવી રહ્યા હતા ત્યારે સિંહ આવતા પશુઓમાં નાસભાગ મચી હતી. આ સમયે એક ગૌવંશ સિંહની નજીક જ ઉભું રહી ગયું હતું. પરંતુ, કોઈ કારણસર સિંહ શિકાર કર્યા વગર જ ત્યાંથી આગળ વધતો જોવા મળ્યો હતો.

ખાંભાના રાયડી ગામની શેરીઓમાં સિંહ પહોંચ્યાં **નવગુજરાત સમચ** > અમરેલી

🎟 અમરેલી જિલ્લામાં ગીર જંગલમાં δdÌ

પશુઓમાં દોડધામ મચી હતી.

» ચોમાસાના કારણે સોમનાથ મંદિરમાં શો બંધ કરાયો

નવગુજરાત સમય > વેરાવળ

🎟 સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રિકો માટે શ્રી સોમનાથ તીર્થના ગૌરવને ઉજાગર કરતો થ્રીડી લાઈટ એન્ડ સાઉન્ડ શો ચોમાસાના વિરામ બાદ, રપમી ઓક્ટોબરથી ફરી શરૂ કરવામાં આવી રહ્યો છે.

તમામ બાબતોને આધુનિક થ્રીડી કરવામાં આવતો હોય છે. ચોમાસાની યાત્રિકો માહિતગાર થાય તે માટે યાત્રીઓમાં પ્રસિદ્ધ છે.

ગમન કર્યું, કઈ રીતે આ તીર્થ પ્રભાસ કહેવાયું, શું છે ધાર્મિક કથા? આ પુર્વે પુનઃ આ શો યાત્રીઓ માટે શરૂ આવશે.

ખાતે તા.25 ઓકટોબર થી લાઈટ 7-45 વાગ્યાનો રહેશે. શનિવાર તથા



સોમનાથ ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, આવનાર ભક્તો શ્રી સોમનાથ ટેકનોલોજીના ઉપયોગથી આવનાર સીઝન પૂર્ણ થતા શ્રી સોમનાથ મંદિર તીર્થના ઇતિહાસથી માહિતગાર થાય, કઈ રીતે ચંદ્રદેવના તપથી ભગવાન લાઇટ એન્ડ સાઉન્ડ શોનું નિર્માશ એન્ડ સાઉન્ડ શો પ્રારંભ થશે. શો સોમનાથ આ ભૂમિ પર પધાર્યા, કઈ કરવામાં આવ્યું છે. આ શો આવનાર નો સમય સાયં આરતી બાદ સાંજે રીતે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની અંતિમ લીલા દર્શાવી નિજધામ આ શો ચોમાસા દરમિયાન પ્રતિવર્ષ રવિવાર તહેવારોના દિવસોમાં યાત્રી

બંધ રહેતા હોય છે. પણ દિપાવલી પ્રવાહને ધ્યાને લઇ બે શો યોજવામાં

ઈકો ઝોનના વિરોધમાં વિસાવદરમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી સાથે આવેદન

મોટી સંખ્યામાં હાજર ખેડૂતોની કાયદો પાછો ખેંચવાની માગણી

નવગુજરાત સમય > જુનાગઢ

🔳 રાજ્ય સરકારે જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં ઈકો સેન્સેટિવ ઝોન અંગે ગેઝેટ બહાર પાડ્યું છે, ત્યારથી જ આ પંથકના ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે. ગામડે-ગામડે વિવિધ વિરોધ કાર્યક્રમો થઈ રહ્યા છે. આજે વિસાવદરમાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજીને ઈકો સેન્સેટિવ ઝોન સામે વિરોધ નોંધાવી આવેદન આપ્યું હતું અને આ કાયદો પાછો ખેંચવા માગ કરી હતી.

સંખ્યામાં ખેડતોએ ટેક્ટર રેલી યોજી ઇકો સેન્સીટીવ ઝોનનો વિરોધ કર્યો હતો અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. કાલસારીથી પ્રાંત અધિકારીની કચેરી

સુધી કિસાનોએ ટ્રેક્ટર રેલી યોજી ઈકો સેન્સેટિવ ઝોન કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે છે અને તેનો પરિપત્ર પણ ક્યાંક અલગ જ આયોજન કર્યું હતું.



હજારોની સંખ્યામાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા આ કાયદો પાછો ખેચે તેવી માંગ કરી હતી.

આ તકે સંયુક્ત કિસાન મોરચાના કન્વીનર પાલભાઈ આંબલિયાએ જણાવ્યું આજે જુનાગઢ જિલ્લાના વિસાવદર હતું જુનાગઢ જિલ્લામાં ઘેડનો પ્રશ્ન, ખાતે સંયુક્ત કિસાન મોરચો, આમ ઈકો સેન્સેટીવ ઝોનનો પ્રશ્ન હોય, પાક આદમી પાર્ટી, કોંગ્રેસ તેમજ હજારોની વીમાનો પ્રશ્ન હોય કે જમીન માપણીનો પ્રશ્ન હોય કે પછી કમોસમી વરસાદનો પ્રશ્ન હોય આ સરકાર ખેડૂતોને નવી વાત કરી કમળ છાપ લોલીપોપ આપે છે. ખેડૂતોને કેવી રીતે ફટકાવવા તેવી નવી વાત કરે છે. ઇકો સેન્સેટિવ ઝોનને લઈ જે ગેજેટ પસાર કરવામાં આવ્યું છે તે અલગ આજે વિસાવદર ખાતે ટ્રેક્ટર રેલીનું

A TRULY INDIAN FOUNDRY

WITH A GLOBAL PRESENCE!

અલગ દર્શાવાય છે. ટ્રેક્ટર ચાલતું હોય ત્યારે પણ ધ્વનિ પ્રદુષણ થાય અને જેસીબી શરૂ હોય તો પણ ધ્વનિ પ્રદૂષણ થાય. ખેતરમાં જે ડીઝલ મશીન મૂકવામાં આવે છે તેમાંથી પણ ધુવાડો નીકળવાનો છે. આ હવાનું પ્રદૂષણ ગણવામાં આવ્યું છે. ત્યારે સરકારે સંપૂર્ણ માહિતી સાથે વિગતવાર ખેડૂતોને સમજાય તેવી વ્યાખ્યા આપવી જરૂરી છે. સરકારે પત્રિકામાં લખાણ કર્યું છે અને વન વિભાગ દ્વારા જે ખેડૂતોને સમજાવવામાં આવ્યા છે તે પ્રમાણે ગેજેટ બહાર પાડવું જોઈએ. ત્યારબાદ ખેડૂતો વિચારશે કે આ કાયદાનો વિરોધ કરવો કે ન કરવો.વિસાવદર તાલુકાના કોંગ્રેસના પ્રમુખ કરસનભાઈ વારગોડિયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા હાલ ગીરના 196 ગામોમાં ઇકોઝોન નામનો કાળો કાયદો લગાવવામાં આવ્યો છે. જેના વિરોધમાં

છે. ઈકો સેન્સેટિવ ઝોનના ગેજેટમાં ધ્વનિ

પ્રદષ્ણની વ્યાખ્યા આપવામાં આવી છે તે

વહીવટદાર કચેરીની યાદીમાં જણાવાયા મુજબ ધનતેરસ નિમિત્તે બુધવાર તારીખ 30ના રોજ સવારે 6:30 વાગ્યે મંગળા બંધ) થશે.

સવારે 5:30 વાગ્યે મંગળા આરતી, બપોરે 1થી 5 અનોસર, સાંજે 5 વાગ્યે

દાવે સમાધાન માટે ગયો હતો.આ બંને

પરિવાર વચ્ચેના ઝઘડામાં કારણ વગર

સેજાઝ વચ્ચે પડતા તેને મોત મળ્યું હતું.

મતક સેજાઝ બે ભાઈ અને ત્રણ બહેનમાં

આશરે 40 કરોડની ડ્યુટીની ગેરરીતિમાં 17 આયાતકારનાં નામ ખુલ્યાં મુન્દ્રામાં સુદાનથી આચાત 100 કરોડનાં તરબૂચ-બીજનાં 200 કન્ટેનર સીઝ

નવગુજરાત સમચ > ભૂજ

🔳 ડિરેક્ટરોટઓફરેવન્યુઈન્ટીલજન્સની ગાંધીધામ શાખાએ એક મહત્ત્વનું ઓપરેશન પાર પાડીને મુન્દ્રામાં સુદાનથી આવેલા 200 જેટલા કન્ટેનર ઝડપી પાડ્યા છે. જેમાં અંદાજે 100 કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતા તરબુચના બીજ મળી આવ્યા છે. આ સમગ્ર કારસામાં 17 ઈમ્પોર્ટર છે અને અંદાજે 39.65 કરોડની દાણચોરી ખુલી છે.

એકમ દ્વારા એકત્ર કરાયેલી ગુપ્ત રહ્યા છે. માહિતીના આધારે જાણવા મળ્યું હતું કે 17 આયાતકારો ડીજીએફટી દ્વારા જારી



મે 2024થી 30મી જૂન 2024 સુધી પ્રતિબંધિત શ્રેણી હેઠળ આવે છે, નિયત કરાયેલા 05.04.2024ના નોટિફિકેશન ફ્રી હતી. 30મી જૂન 2024 સુધી જારી સમયમર્યાદાથી વિરુદ્ધ ગત બે મહિનમાં નંબર 05/2023ની જોગવાઈઓનો કરાયેલા બોર્ડના બિલ પર મોકલેલા આયાતકારોએ તરબુચના બીજ આયાત

લેડીંગના નકલી બિલ કસ્ટમ્સને સબમિટ કરવામાં આવ્યા હતા. જે 30મી જૂન 2024 પહેલા બોર્ડની તારીખે મોકલવામાં



» ધનતેરસ-ભાઈબીજે સવારે 6:30 વાગ્યે , રૂપચૌદશ-દિવાળીએ સવારે 5:30 વાગ્યે મંગળા આરતી થશે

કર્યા હતા, જે નોટિફિકેશનનું સંપુર્શ

તપાસમાં જાણવા મળ્યું કે, ડીજીએફટી

સૂચનાની અસરને બાયપાસ કરવા માટે,

આવ્યા હતા. ટેકિંગના આધારે અને સર્ચ

દરમિયાન રિકવર થયેલા લેડીંગના અસલ

બિલના આધારે, વાસ્તવિક તારીખ મળી

આવી હતી. જે 30મી જૂન, 2024 પછીની

સામે આવ્યું હતુ. જપ્ત માલનું કુલ મૂલ્ય

આશરે 100 કરોડ (એકસો કરોડ) છે

જ્યારે કે ડ્યુટીની સંડોવણી સાથે 39.65

કરોડ થવા જાય છે. તદનુસાર, આયાત

માલ જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ

ઉલ્લંઘન હતું.

નવગુજરાત સમય > દ્વારકા

🎫દીપાવલીના પર્વને અનુલક્ષીને દ્વારકાધીશ મંદિરમાં થતા વિવિધ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મંદિર દ્વારા આ માટેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.

આ અંગે દ્વારકાધીશ મંદિર

રૂપ ચૌદશ તથા દિવાળીની ઉજવણીના ભાગરૂપે ગુરુવાર તા. 3ામીના રોજ ઉત્થાપન, રાત્રે 8 વાગ્યે હાટડીના દર્શન વહીવટદારને એક યાદીમાં જણાવાયું છે.

સમયસર કૃષિ સહાય આપવાની માગ સાથે ગાડું લઈ કલેક્ટર કચેરીએ દેખાવો

» રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ કરાયો

નવગુજરાત સમય > રાજકોટ

🔳 રાજ્ય સરકારે ખેડૂતો માટે કૃષિ પેકેજ જાહેર કર્યું છે, પરંતુ સમયસર ખેડૂતોને સહાય મળે તેવી માગ સાથે રાજકોટમાં આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ કર્યો હતો. આપના આગેવાનો, કાર્યકરો આજે જિલ્લા પંચાયતથી બળદગાડા સાથે રેલી યોજી કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદન આપ્યું હતું.

રાજકોટમાં આમ આદમી પાર્ટીના યુથ વિંગ અધ્યક્ષ પિયુષભાઇ ભંડેરી પોસ્ટર બેનરો સાથે બળદ ગાડુ લઈને




પહોંચ્યા હતા.

આવેદનપત્રમાં આપના કરાઈ છે. આગેવાનોએ જણાવ્યું છે કે, કૃષિ તેમજ આગેવાનો-કાર્યકરો જિલ્લા રાહત પેકેજ જાહેર કર્યું તે આવકાર્યછે. લીલાદુકાળ જેવી સ્થિતી સર્જાઇ છે પંચાયત ચોકમાં એકઠા થયા હતા. આ પણ આવું પેકેજ લોલીપોપ બનાવવાને ત્યારે બરબાદ થઇ ગયેલા ખેડૂતોને સૌ કૃષિ પેકેજ નામનું લોલીપોપ નહીં બદલે જો સમયસર ચુકવાય તો શિયાળુ પાકના વાવેતર પહેલા રાહત ખરેખર સહાય આપો, લીલો દુષ્કાળ શિયાળુ પાકના વાવેતરમાં ખેડૂતોને ચુકવાય તેવી માંગ સાથે પાકધીરાણ જાહેર કરો વિગેરે માંગ દર્શાવતા સહાય ભારે રાહતરૂપ બને તેમ છે. માફ કરવામાં આવે તેવી પણ ખેડૂતો આ ઉપરાંત કૃષિ લોન માંડવાળ કરવા દ્વારા માગણી કરાઇ છે.

સૂત્રોચ્ચાર કરતા કલેક્ટર કચેરીએ અને ખાતર, બિયારણ દવામાં 50 ટકા સબસીડી જાહેર કરવા પણ માંગણી

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટમાં



તેમજ 9:45 વાગ્યે શયન (મંદિર બંધ)

મંગળા આરતી, 1થી 5 અનોસર અને 5

વાગ્યે ઉત્થાપન બાદ રાત્રે 9:45 વાગે અનોસર થશે તેમ દ્વારકાધીશ મંદિરના



સેજાઝ ઉપર છરીના ઘા ઝીંકી દેતા તેનું

થશે. અન્નકૂટ ઉત્સવના દર્શન શુક્રવાર તારીખ 1 નવેમ્બરના રોજ થશે. જેમાં સવારે 6 વાગ્યે મંગળા આરતી, 1થી 5 અનોસર, સાંજે 5થી 7 અન્નકટના દર્શન

બાદ પોણા દસ વાગ્યે મંદિર બંધ થશે. નુતન વર્ષ નિમિત્તે શનિવાર તારીખ આરતી બાદ બપોરે 1થી 5 અનોસર 2ના રોજ સવારે 6:30 વાગ્યે મંગળા (મંદિર બંધ), 5 વાગ્યે ઉત્થાપન તેમજ આરતીના દર્શન અને 1થી 5 અનોસર, રાત્રે પોશા દસ વાગ્યે અનોસર (મંદિર 5 વાગ્યે ઉત્થાપન અને રાત્રે 9:45 વાગે અનોસર થશે. ભાઈબીજ નિમિત્તે રવિવાર તા. 3ના રોજ સવારે 6:30 વાગ્યે

નવગુજરાત સમય > સુરેવ્દ્રનગર

બજાણા પાસે એસટી

બસ સાથે અકસ્માતમાં

કારનો બુકડોઃ બે ગંભીર

📰 પાટડી તાલકાના બજાણા નજીક રેલવે ફાટક પાસે ગજરાત એસટી બસ અને એક કાર વચ્ચે ટક્કર થયા બાદ કારનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં એબે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા છે. રાધનપુર રાજકોટ રૂટની બસ

પાટડીથી રાજકોટ તરફ જઈ રહી હતી. દરમિયાન પાટડીના બજાશા નજીક આવેલા રેલવે ફાટક પાસે પહોંચતા સામેથી પરઝડપે આવી રહેલી એક કાર સાથે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર બે લોકોને ગંભીર ઈજાઓ રહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને તાકીદે સારવાર અર્થે 108 એમ્બ્યલન્સ વાનમાં પાટડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતને પગલે હાઇવે પર ટાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ગુમાવવાનો વારો આવ્યો છે. આ બનાવથી મૃતકના પરિવારમાં શોક વ્યાપી ગયો છે. શાપર-વેરાવળના આનંદ સોસાયટીમાં રહેતા અને નોનવેજની દુકાન ચલાવતા સેજાઝ ઈસબભાઈ હિંગોરા (ઉ.૨૫) ગઈ કાલે રાત્રે ૯ વાગ્યાના સુમારે મામદેવના મંદિર પાસે હતો ત્યારે મુકેશ ધીરુ માલકીયા. દિલીપ ભરત રાઠોડ. મિલન રમેશ રાઠોડ અને રાજેશ ભનુ ડાભીએ તેના

GUJARAT METRO RAIL CORPORATION (GMRC) LIMITED (SPV of Govt. of India and Govt. of Gujarat) Block No.1, First Floor, Karmayogi Bhavan, Sector 10/A, Gandhinagar: 382010, Gujarat. (CIN): U60200GJ2010SGC059407

Gujarat Metro Rail Corporation (GMRC) Limited, jointly and equally owned by Government of India and Government of Gujarat, is entrusted with the responsibility of implementation of Metro Rail Projects in Gujarat and its Operations & Maintenance.

The search cum selection committee of GMRCL invites applications from qualified and experienced candidates for the post of Joint Managing Director. For detailed recruitment notification, please visit career page of our website www.gujaratmetrorail.com. Last date to apply is 9th November, 2024.



AHMEDABAD MUNICIPAL CORPORATION Water Operation (E.& M.- East) Department

E-Tender Notice

Supply of 100 Kg. Capacity 500 nos. Liquid Chlorine Cylinders to fill up Liquid Chlorine as per IS: 3196 (Part-4)/2001 to Ahmedabad Municipal Corporation, Amdavad.

Last Date of Online Tender	Date: 21/11/2024		
Submission	up to 18:00 Hrs.		
Last Date of Tender	Date: 22/11/2024		
Submission (Hard Copy)	up to 16:00 Hrs.		
Date of Tender	Date: 22/11/2024		
Opening	at 17:00 Hrs.		
Detail and Tenders Available on:	www.tendernprocure.com		

🔲 રાજકોટના શાપર વેરાવળમાં એક યુવકની પારકા ઝઘડામાં સરાજાહેર હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. શાપર-વેરાવળ પોલીસે હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીને



સમાધાન માટે વચ્ચે પડેલા યુવાનને જીવ

ઘટના સ્થળે જ મોત થયું હતું.આ બનાવની પકડી લીધા છે.

મિત્રના પરિવારની મહિલાના ઝઘડામાં

જાણ થતાં શાપર-વેરાવળ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બનાવની જાણ થતાં સેજાઝના ભાઈ અલ્તાફ તથા તેના માતા સહિતના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

નાનો હતો તેનો ભાઈ અલ્તાફ તથા બહેન નઝમા તથા કુલસમ બેન બાનુબેન, મોટા છે ત્યારે એજાઝ સૌથી નાનો હતો. તેના થોડા હત્યા પાછળનં કારણ જાણવા પોલીસે વખત પર્વે જ મસ્કાન સાથે લગ્ન થયા બાદ તપાસ કરતા પ્રાથમિક તપાસ દરમિયાન સેજાઝને હાલ સવા વર્ષનો પુત્ર સુદાન છે. જાણવા મળ્યું હતું કે, મૃતક સેસાઝતેના ભાઈ સેજાઝના મોતથી માસુમ પુત્રએ પિતાની અલ્તાફ સાથે નોનવેજની દુકાન ચલાવે છે. છત્રછાયા ગુમાવી છે. પોલીસે સેજાઝની તેના મિત્રના પરિવારની મહિલાને શાપર-હત્યા અંગે તેના ભાઈની ફરિયાદના વેરાવળમાં રહેતા મુકેશ નામના શખ્સના આધારે ગુનો નોંધી હત્યામાં સંડોવાયેલા

પરિવારની મહિલાઓ સાથે ઝઘડો થયો એક જ પરિવારના ચાર સભ્યોને સકંજામાં લઈ વિશેષ તપાસ શરૂ કરી છે. હતો. આ બે પરિવાર વચ્ચેની મહિલાઓ

જાદેર નિવિદા નં. ૨૩ સને ૨૦૨૪-૨૫

કાર્યપાલક ઈજનેરશ્રી, અમદાવાદ (મા×મ) વિભાગ, અમદાવાદ, બ્લોક–સી, બીવે માળ, બદ્દમાળી ભવન, ફાઈવ–ઈન્ન રોક, વસ્ત્રાપુર, અમદાવાદ–૩૮૦ ૦૫૨ દ્વારા ૨ (બે) મકાનનાં કામનાં ટેન્ડરો માંગવામાં આવે છે. જેની અંદાજીત કિંમત રૂ.૩૬.૬૩ લાખ થી રૂ.૩૮.૫૯ લાખ થવા જાય છે. આ કામના ટેન્ડર ડોક્યુમેન્ટ https://tender.nprocure.com ชนะ di.จน/ ๑०/२०२४ थी जोई शडाशे तथा તા.૧૧/૧૧/૨૦૨૪ સુધીમાં ટેન્ડરો ઓનલાઈન ભરવાનાં રહેશે.

આ અંગેની વિગતવાર નોટિસ માફિતી ખાતાની વેબસાઈટ www.statetenders.gujarat.gov.in ઉપરથી જોવા મળશે. તેમજ વધુ વિગતો રજા સિવાયનાં કચેરી સમય દરમીયાન આ કચેરીનો રૂબરૂ સંપર્ક કર્યેથી મળશે. તેમજ ભવિષ્યમાં જરૂરી સુધારા ઓન-લાઈન જોવા વિનંતી છે. ક્રમાંક/સંમાનિ/અમદ/૧૦૪૭/૨૦૨:



(સ્થાવર અને જંગમ મિલકત માટે) બાથી, નીચે સહી કરનાર એચડીએફ્સી બેંક લિ., રજીસ્ટર્ડ ઓફિસ બેંક હાઉસ, સેનાપતિ બાપટ મા

આવા, ગાય રાહા કરવાર અવડાઅરદા બાંક પડ, રછુટડ આવેલ બાંક વાદા, સંગાયતા ભાર્ય ગાગ, લોઅર પરેલ, મુંબઇ – ૪૦૦ ૦૧૩ અને અન્ય કાયાંલય કબે માળ, શિવાલીક-૩, ડ્રાઇવ ઇન સિનેમાં પાસે ડ્રાઇવ ઇન રોડ, બોડક્ટેવ, અમદાવાદ ના અધિકૃત અધિકૃત્તિએ સિક્યોરિટાઇઝેશન એન્ટ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શીયલ એસેટ્સ એન્ડ એન્ફ્રેસ્નેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ અધિનિયમ ૨૦૦૨ (ત્યારબાદ "કહેવાતા અધિનિયમ" તરીકે ઓળખવામાં આવે છે) ની કલમ ૧૩(૧૨) વિયમ ૩ સાથે વંચાણે લેતા અને સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલા ૨૦૦૨ (ત્યારબાદ "કહેવાતા નિયમે" વરી ઓળખવામાં આવે છે) સાથે વંચાણે લેતા મળેલી સત્તાની રૂએ તારીખ ૦૮.૧૦.૨૦૧૫ ના રોખ ઉદ્યારકર્તા (૧ મહાવીર ટેગ એન્ડ એસેસરીઝ પ્રા. લિ. અને તેના જામોનદારી (૨) શ્રી છુતેન્દ્ર બાબુલાલ ભણસાલી (૩) શ્રે બાબુલાલ છગનલાલ ભણસાલી (૪) અરવિંદ બાબુલાલ ભણસાલી (૫) શ્રીમતી ગીતાદેવી બાબુલાલ ભણસાલી (૬) શ્રીમતી વીણા જીતેન્દ્ર ભણસાલી (૭) શ્રીમતી સોનલ અરવિંદ ભણસાલી અને (૮) શ્રીમતી ારજુદેવી છગનલાલ ભણસાલી ને માંગણા નોટીસ જારી કરીને નોટીસમાં જણાવેલ રકમ રૂા ક, ૮૩, ૩૦, ૩૧૫.૪৮/- (૩). નવ કરોડ ત્યાંસી લાખ ત્રીસ હજાર પ્રણસો પંદર અને સડતાળીસ પૈસા કકત તા. ૩૧.૦૫.૨૦૧૫ સુધી સાથે તા. ૦૧.૦૬.૨૦૧૫થી લાગુ આગામી વ્યાજ સાથે નોટીસની તારીખ થી દ્

લા કેમબા હેપ સુક્રવવામાં જણાવેલ. દિવસોની અંદર ચુક્રવવામાં જણાવેલ. ઉધારકતાં, જમીનદારો, ગિટવેદારો, મૃતકના કાયદેસરના વારસદારો (જો હોય તો) રક્ષ્ ચુકવવામાં કસુરવાર થતાં આથી ઉધારકર્તાઓ, જમીનદારો, ગિરવેદારો અને મૃતકના કાયદેસરન વારસદારો (જો હોય તો) અને સામાન્થત: જોટેર જનતાને નોટીસ થી જણાવવામાં આવે છે છે. અધિનિયમ ମାଧିନିଥନା କଙ୍କମ ୩३(१) କା ଶାଶ નિયમ ૮ ને વંચાણે લેતા આપેલી સત્તાની રૂએ તા. ૨૦.૧૦.૨૦૨ ના રોજ એચડીએફસી બેંક લિ. ના અધોહસ્તાક્ષરીએ નીચે જણાવ્યા મુજબની મિલકતનો પ્રત્થાર કબજો લીધેલ છે.

ઉધારકર્તા, ભામીનદારો, ગિરવેદારો, મૃતકના કાયદેસરના વારસદારો (બે હોય તે) તથા જાહે બતાને આથી સદરહુ મિલકત અંગે કોઈપણ જાતનો વ્યવહાર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે સદરહુ મિલક્ત અંગે કરેલો કોઈપણ વ્યવહાર **એચડીએફ્સી બેંક** લિ.ની રકમ **રૂા. ૯,૮૩,૩૦,૩૧૫.૪**૯, (રૂા. નવ કરોડ ત્યાંસી લાખ ત્રીસ હજાર ત્રણસો પંદર અને સુડતાળીસ પૈસા ફક્ત) અને વ્યાજ અને તેન

ઉપરના ખર્ચાના બોજાને આધીન રહેશે. ઉધારકર્તા, જામીનદારો, ગિરવેદારો, મૃતકના કાયદેસરના વારસદારો (જો હોય તો) કાયદાની કલમ ૧૩ની પેટા કલમ (૮) ની જોગવાઈ પ્રત્યે ઉધારકર્તાનું મુકસ્ટ મિલક્ત છોડાવવા માટે મળવા પાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે.

સલામત મિલકતનું વર્ણન

થળ : અમદાવાદ

સરજુદેવી છગનલાલ ભણસાલીની માલિકીનું ટેનામેન્ટ નં. ૭/બી, એફ.પી. નં. ૨૬૯/બી ટીપીએસ ૧૪ દિપિકા સોસાચરી, મોજે દરિયાપુર, કાણપુર સળ ડિસ્ટ્રી. અમદાવાદ - ૬ (નારોડા) અને ધ્વેચેન્ટરી મુજ જંગમ મિલકત. લેની ચતું:સીમા: ઉત્તરે: જોડેની મિલકત, પૂર્વે: ચુનિટ નં. ડાંચો, દક્ષિણે: સોસાચટી રોડ પશ્ચિમે: ચુનિટ નં. ૮/એ અને ઇન્વેન્ટરી મુજબ જંગમ મિલકત. તારીખ : ૨૦.૧૦.૨૦૨૪, અનિલ સાંખલા, અધિકૃત અધિકાર

ડિપાર્ટમેન્ટ ફોર સ્પેશ્યલ ઓપરેશન્સ, એચડીએફસી બેંક લ





GUJARAT INTRUX LIMITED CIN: L27100GJ1992PLC016917

Regd. Office : Survey No. 84/P,17 K.M. Rajkot-Gondal Road, Village : Shapar, Dist. Rajkot-360 024. India

EXTRACT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED ON SEPTEMBER 30, 2024

Particulars	Quarter ended 30.09.2024 (Un-Audited)	Year to date figures 30.09.2024 (Un-Audited)	Corresponding 3 Months ended in the previous year 30.09.2023 (Un-Audited)	Year to date previous year ended 31.03.2024 (Audited)
Total Income from operations (net)	1640.16	3199.19	1535.32	5720.18
Net Profit/ (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	352.59	701.07	326.23	1015.69
Net Profit/ (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	352.59	701.07	326.23	1015.69
Net Profit/ (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	270.47	530.78	234.59	741.48
Total Comprehensive Income for the period [(Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	270.47	530.78	234.59	735.82
Equity Share Capital	343.53	343.53	343.53	343.53
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of Previous year)	5802.61	5802.61	5508.70	5855.84
Earning Per Share (before extraordinary items) (of Rs.10/- each) (not annualised except last column) Basic : Diluted :	7.87 7.87	15.45 15.45	6.83 6.83	21.42 21.42
Earning Per Share (after extraordinary items) (of Rs.10/- each) (not annualised except last column) Basic : Diluted :	7.87 7.87	15.45 15.45	6.83 6.83	21.42 21.42

Notes :

[1] The above is an extract of the detailed format of Financial Results for the quarter and half year ended on 30.09.2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and amendments thereof. The full format of the financial results are available on the website of BSE at www.bseindia.com and on Company's website at www.gujaratintrux.com.

[2] This statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind-AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognized accounting practices and policies to the extent applicable

> FOR AND ON BEHALF OF THE BOARD OF **GUJARAT INTRUX LIMITED**

PLACE : SHAPAR (Dist. RAJKOT) DATE : 24-10-2024

DHIRAJ D. PAMBHAR MANAGING DIRECTOR DIN :- 00187371



GUJARAT INTRUX LIMITED

STEEL AND ALLOY STEEL SAND CASTING

Survey No. 84/P., 17 K.M. Rajkot-Gondal Road, Village: Shapar, Dist.: Rajkot-360 024. India Phone : 02827-252851 www.gujaratintrux.com